

ડપોઝિਟ સાਮੇ ਐਡਵਾਂਸ ਮਾਟੇ ਅਰਜ਼ੀ ફੋਰਮ

ਪੀਐਨਬੀ- 308 (ਆਰ)

ਮੇਨੇਜਰ/ਓਨ-ਯਾਜ਼ ਸਥਾਨ_____

ਸ਼ਾਖਾ ਕਥੇਰੀ_____ਤਾਰੀਖ _____

ਸਾਡੇਬਸ਼ਰੀ,

ਕੁਪਾ ਕਰੀਨੇ ਮਨੇ/ਅਮਨੇ _____ਨੇ ਨੀਯੇ ਜਾਗਾਵੇਲ ਮਾਰਾ/ਅਮਾਰਾ ਫ਼ਿਕ੍ਸਡ/ਆਰ.ਡੀ. ਯਾਤਾ ਅਥਵਾ ਐਫ਼ਡੀ/ ਆਰਡੀ ਯਾਤਾਨਾ ਨਾਮ ਪਰ ਲੋਨ ਆਪੋ _____ਜੇਮਯੋ ਮਨੇ/ਅਮਨੇ ਵਨਿੰਤੀ ਕਰੇਲ ਆ ਐਡਵਾਂਸ ਮਾਟੇ ਸੁਰਕੁਸ਼ਾ ਤਰੀਕੇ ਓਫ਼ਰ/ਜਮਾ ਕਰਵਾ ਸੰਮਤਿਆਪੀ ਓ, ਜੇਨੀ ਵਗਿਤੋ ਨੀਯੇ ਮੁਜਬ ਓ:

ਕ੍ਰਮ ਨੰਬਰ	ਪ੍ਰਕਾਰ ਨੀ ਡਪੋਜ਼ਿਟ (ਐਫ਼ਡੀ/ਆਰਡੀ/ਕੋਓ ਅਨੁਥ)	ਮਾਲਕਿੰ (ਸਵਯੰ/ਤ੍ਰੀਜ਼ੋ ਪਕੁਖ)	ਯਾਤਾ ਨੰਬਰ.	ਯੋਲਵਾਨੀ ਤਾਰੀਖ਼ ਡਪੋਜ਼ਿਟ	ਤਾਰੀਖ਼ ਪਰਪਿਕੁਵਤਾ	ਵ੍ਯਾਜ਼ ਦਰ	ਵ੍ਯਾਜ਼ ਸਫ਼ਤਿ ਡਪੋਜ਼ਿਟਨੀ ਰਕਮ, ਜ਼ੋ ਕੋਓ ਡੋਯ ਤੋ	ਡਾਲਨੀ ਲਯਿਨ, ਜ਼ੋ ਕੋਓ ਡੋਯ ਤੋ	ਡਪੋਜ਼ਿਟ ਯਾਤਾ ਮਾਟੇ ਆਫ਼ੇਸ਼ (ਓਟੋ- ਨਵੀਕਰਾ/ਓਟੋ- ਬੰਧ)
		ਕੁਲ							

ਜ਼ਰੂਰੀ ਲੋਨਨੀ ਰਕਮ	
ਜ਼ਰੂਰੀ ਲੋਨਨੋ ਪ੍ਰਕਾਰ	ਮਾਂਗ ਲੋਨ/ਓਵਰਡ੍ਰਾਫ਼ਟ

1. ਡੁੰ/ਅਮੇ ਪੁਸ਼ਟਿਕਰੀਐ ਓੀਐ ਕੇ ਓਪਰੋਕੁਤ ਓਲੇਯਤਿ ਡਪੋਜ਼ਿਟਿ (ਯੋਗ੍ਯ ਰੀਟੇ ਡਸ਼ਿਯਾਜ਼ ਕਰੇਲ) ਸੁਰਕੁਸ਼ਾ ਤਰੀਕੇ ਤਮਨੇ ਸੋਪਵਾਮਾਂ ਆਵੀ ਓ, ਜੇਨੇ ਡਵੇ ਪਓ ਤਮਾਰੀ _____ਸ਼ਾਖਾ ਦੁਵਾਰਾ ਜਾਰੀ ਕਰਾਯੇਲ 'ਸੁਰਕੁਸ਼ਾ' ਤਰੀਕੇ ਓਯਯਵਾਮਾਂ ਆਵਸ਼ੋ.
2. ਜ਼ੋ ਓਪਰੋਕੁਤ ਡਪੋਜ਼ਿਟਿ ਰਸੀਦਨੁੰ ਨਵੀਕਰਾ ਕਰਵਾਮਾਂ ਆਵੇ ਤੋ, ਤਮੇ ਨਵੀਕਰਾ ਕਰੇਲੀ ਫ਼ਿਕ੍ਸਡ ਡਪੋਜ਼ਿਟਿ ਰਸੀਦਨੇ ਓਪਰੋਕੁਤ ਲੋਨ ਮਾਟੇ ਸੁਰਕੁਸ਼ਾ ਤਰੀਕੇ ਰਾਯਸ਼ੋ. ਜ਼ੋ ਮਾਰਾ/ਅਮਾਰਾ ਦੁਵਾਰਾ ਮਾਂਗ ਲੋਨ ਪਸੰਦ ਕਰਵਾਮਾਂ ਆਵੇ ਓ, ਤੋ ਮਨੇ ਡਪੋਜ਼ਿਟਿ (ਐਫ਼ਡੀ/ਆਰਡੀ) ਮਾਟੇ ਸਵਯੰ ਨਵੀਕਰਾ ਸੁਵਧਾਨੀ ਮੰਜ਼ੂਰੀ ਆਪਵਾਮਾਂ ਆਵਸ਼ੋ ਨਡੀ. *
3. ਡੁੰ/ਅਮੇ ਵਧੁ ਪੁਸ਼ਟਿਕਰੀਐ ਓੀਐ ਕੇ ਜ਼ੋ ਤਮੇ ਓਧਾਰ ਲੇਨਾਰਨੇ ਓਪਰੋਕੁਤ ਵਨਿੰਤੀ ਕਰੇਲ ਲੋਨਨੁੰ ਨਵੀਕਰਾ ਕਰਵਾਨੀ ਮੰਜ਼ੂਰੀ ਆਪੋ ਓ, ਤੋ ਓਪਰ ਜਾਗਾਵੇਲ ਡਪੋਜ਼ਿਟਿ ਡੇਕ ਪਾਸੇ ਸੁਰਕੁਸ਼ਾ ਤਰੀਕੇ ਪਡੇਲਾਨੀ ਜੇਮ ਜ ਯਾਲੁ ਰਡੇਸ਼ੋ.
4. ਨਯਿਤ ਰਕਮ ਅਨੇ ਅਨੁਥ ਸ਼ੁਲੁਕ, ਜ਼ੋ ਕੋਓ ਡੋਯ ਤੋ, ਤਮਾਰਾ ਦੁਵਾਰਾ ਓਪਰੋਕੁਤ ਜਾਗਾਵੇਲ ਡਪੋਜ਼ਿਟਿ(ਓ)ਨੀ ਆਵਕਮਾਂਥੀ ਤੇਨੀ ਪਰਪਿਕੁਵਤਾ ਪਡੇਲਾਂ ਅਥਵਾ ਤੇਨਾ ਪਰ ਕੋਓਪਾਯ ਸਮਥੇ ਐਡਜਸਟ ਅਨੇ ਵਨਿਯੋਗ ਕਰਵਾਮਾਂ ਆਵਸ਼ੋ.

તમારા વર્વિકબુદ્ધિથી સવાય કે લોન અન્યથા સંપૂર્ણપણે એડજસ્ટ કરવામાં આવે, તમારા દ્વારા કરવામાં આવેલી લેખતિ માંગ પર બે દવિસની અંદર.

5. હું/અમે બેકને ઉપરોક્ત લોન પર ચૂકવવાપાત્ર વ્યાજને સમય સમય પર બાકી લેણાંના એડજસ્ટમેન્ટ માટે ફાળવવાનો અધકાર આપીએ છીએ. આ અધકાર હું/અમારા દ્વારા વ્યાજની ચૂકવણી/જમા કરવાના સંદર્ભમાં ઉપરોક્ત લોન ખાતું ખોલતી વખતે આપવામાં આવેલી અન્ય કોઈપણ સૂચનાઓ હોવા છતાં પણ ચાલુ રહેશે.

6. હું/અમે બેકને મારા/અમારા બચત/ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતાની બાકી રકમ જપ્ત કરવાનો અને તેમાંથી ઉધાર લેનાર પાસેથી બાકી નીકળતી રકમ એડજસ્ટ કરવાનો અધકાર આપીએ છીએ.

7. હું/અમે તમને અધકૃત કરીએ છીએ અને પુષ્ટિકરીએ છીએ કે ઉપરોક્ત લોન/ઓવરડ્રાફ્ટ માટેની જામીનગીરી કોઈપણ અન્ય મારી/અમારી જવાબદારી અને બેકની તરફેણમાં વર્તમાન અને ભવિષ્યની જવાબદારીઓ માટે પણ જામીનગીરી રહેશે, જેમાં તેની વધારાની આવકનો પણ સમાવેશ થાય છે અને બેકને મને/અમને સંદર્ભ આપ્યા વના તેને જાળવી રાખવા/વસૂલ કરવા/ઉપયોગ કરવા/યોગ્ય કરવાનો અધકાર રહેશે.

8. એકથી વધુ ડિપોઝિટ સામે DL/ODના કસિસામાં, દરેક નવીકરણ/બંધ થવા પર ડિપોઝિટ, હું/અમે બેકને બાકી રહેલી ડિપોઝિટ(ઓ)ના ભારતિ ROI અનુસાર લોન ખાતાના વ્યાજ દરને બદલવાનો અધકાર આપીએ છીએ.

9. પ્રતજિઆ કરેલી જામીનગીરીની આવકમાંથી બેકના લેણાંના એડજસ્ટમેન્ટ પર, જો કોઈ વધારાની રકમ હોય, તો બેક મારા/અમારા બચત/ચાલુ ખાતા નંબર _____/લાભાર્થી(ઓ)ના નામે _____ સમયગાળા માટે FDR જારી કરી શકે છે/પરચુરણ ખાતામાં મૂકી શકાય છે અને તેના નકિલ માટે અમારી સૂચનાઓ મેળવી શકાય છે/પે ઓર્ડર/ડ્રાફ્ટ દ્વારા મને/અમને મોકલી શકાય છે.

10. હું/અમે સમય સમય પર એડવાન્સ માટે બેકના નર્ધિધારતિ ધોરણો/હયાત માર્ગદર્શકિાનું પાલન કરવાનું અને તમામ પ્રોસેસિંગ, કાનૂની, સ્ટેમ્પિંગ અને આકસ્મિક ખર્ચ અને શુલ્ક વગેરે ચૂકવવાનું વચન આપીએ છીએ.

11. હું/અમે પુષ્ટિકરીએ છીએ કે, મે/અમે કોઈ અન્ય બેક/ફાઇનાન્સયિલ ઇન્સ્ટિટ્યૂશન/કોર્ટ/વ્યક્તિ(ઓ)ની તરફેણમાં મારી/અમારી ફક્સિડ ડિપોઝિટિ રસીદ ગીરવે/જમા કરાવી નથી અને અમારો કોઈ કોર્ટના સમાવેશ હેઠળ નથી. 12. હું/અમે દરેક રીતે સાચી, યોગ્ય અને સંપૂર્ણ છે.

નામ _____ તમરો વશિવાસુ,

વ્યવસાય _____

સરનામું _____ સહી

*ફક્સિડ ડિપોઝિટિ રસીદ સવાયની જામીનગીરી કાઢી નાખો.

થાપણદારની સંમતિ, જ્યાં થાપણદાર સવિયના તૃતીય પક્ષ, ઓવરડ્રાફ્ટ/માંગ લોન માટે વનિંતી કરે છે

હું / અમે _____ તમને ` _____ ની ઉપર જણાવેલ ઓવરડ્રાફ્ટ/માંગ લોન મંજૂર કરવાની વનિંતી કરું છું
_____ માત્ર) _____ તરફથી _____ શ્રી./ _____ શ્રીમતી _____ /
મેસર્સ _____ તમારી બેંકમાં મારી / અમારી ઉપર જણાવેલ ફક્સિડ ડિપોઝિટ /
રકિરગિ ડિપોઝિટની સુરક્ષા પર.

હું/અમે સંમત છીએ કે સુરક્ષા તરીકે ઓફર કરવામાં આવતી ફક્સિડ ડિપોઝિટ પર વ્યાજ / સૂત્રોત પર કર કપાત
ફક્સિડ ડિપોઝિટ ધારકના નામે જમા / કપાત કરવાનું ચાલુ રહેશે.

હું/અમે પુષ્ટિકરીએ છીએ કે, મે / અમે મારી/અમારી ફક્સિડ ડિપોઝિટની રસીદ અન્ય કોઈ બેંક/ નાણાકીય સંસ્થા
/કોર્ટ/ વ્યક્તિ(ઓ)ની તરફેણમાં ગીરવે/જમા કરી નથી અથવા તે કોઈપણ કોર્ટના પ્રતિબંધ આદેશ હેઠળ છે. મે
અરજીની તમામ વગિતો વાંચી છે અને પુષ્ટિકરું છું કે બધી

અરજી ફોર્મમાં આપવામાં આવેલી વગિતો અને માહિતી સાચી, યોગ્ય, સંપૂર્ણ અને તમામ પાસાઓમાં સ્વીકાર્ય છે.

માત્ર શાખા ઉપયોગ માટે

થાપણદાર(ઓ)ની સહી(ઓ) અને માહિતી આપવામાં
આવી છે તે ચકાસવામાં આવી છે અને યોગ્ય જણાઈ છે

મેનેજરનો આદેશ

અધિકૃત અધિકારી

મંજૂર

પીએનબી- 308 (આર)